



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય

આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ- ૩૮૮૦૦૧



પશુચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ઇન્ડીયન સોસાયટી ઓફ વેટરનરી ફાર્મેકોલોજી (ઔષધિશાસ્ત્ર)નો ત્રિદિવસીય પરિસંવાદ ૫- ૭ ડિસેમ્બર, ૨૦૧૮ દરમ્યાન યોજાશે

ઇન્ડીયન સોસાયટી ઓફ વેટરનરી ફાર્મેકોલોજી અને ટોક્સિકોલોજીનો અઢારમો ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે તા. ૫ થી ૭ ડિસેમ્બર, ૨૦૧૮ દરમ્યાન યોજાશે. આ સંસ્થા વર્ષ ૨૦૦૦ માં સ્થાપવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીઓમાં દવાઓના સુચારૂ ઉપયોગ માટે સંશોધન તથા શિક્ષણને દિશા સૂચન કરવાનો છે. આ સંમેલનમાં દેશનાં દરેક ખૂણામાંથી આશરે ૩૦૦ થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષકો, અધિકારીઓ, નિતિ-નિર્માતાઓ, ઔદ્યોગિક વ્યક્તિઓ તથા પશુપાલકો ભાગ લેશે.

આ રાષ્ટ્રીય પરિસંવાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનાં “વન વર્લ્ડ- વન હેલ્થ” ના ધ્યેય મુજબ માણસો તથા પ્રાણીઓનાં પરસ્પર સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. વધુમાં પ્રાણીઓમાં વપરાતી દવાઓના સુચારૂ ઉપયોગ દ્વારા પ્રાણીઓનાં દૂધ, માંસ તથા પક્ષીઓનાં ઈંડામાં આવી દવાઓનાં પ્રમાણ ઘટાડવા માટેનાં ઉપયોગ પર પણ ગહન ચર્ચા થશે. માણસોમાં આવા એન્ટીબાયોટીક રેસીડ્યુવાળા દૂધ, માંસ કે ઈંડા ખાવાથી એન્ટીબાયોટીક રેજિસ્ટન્સનું પ્રમાણ જોવા મળે છે. પ્રાણીઓની પેદાશમાં એન્ટીબાયોટીકનું પ્રમાણ ઘટાડવા તથા તેની માણસોનાં શરીર પર માઠી અસર ન પડે તે માટે ખાસ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદમાં મુખ્ય અતિથિ વિશેષશ્રી ડો. કે. એમ. બઝરબરૂઆ, માનનીય કુલપતિશ્રી, આસામ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી; એવં અતિથિ વિશેષશ્રીઓ- ડો. એ. કે. શ્રીવાસ્તવા, ચેરમેન, ભારતીય કૃષિ વૈજ્ઞાનિક ચયન મંડળ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ, નવી દિલ્હી; ડો. પી. ડી. જુથાલ, માનનીય કુલપતિશ્રી, નાનજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી, જબલપુર; પ્રોફેસર આર. કે. ગોયલ, દિલ્હી ફાર્માસ્યુટીકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, દિલ્હી તથા પ્રોફેસર ગયા પ્રસાદ, માનનીય કુલપતિશ્રી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, મેરઠ પધારવાના છે. આ ઉપરાંત ઇન્ડીયન સોસાયટી ઓફ વેટરનરી ફાર્મેકોલોજી અને ટોક્સિકોલોજીનાં પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો તથા લાઈફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનાં છે.

આ પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો. એન.સી. પટેલ તથા સંશોધન નિયામક અને અનુસ્નાતક વડાશ્રી ડો. કે. બી. કથીરિયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ પરિસંવાદને સફળતમ બનાવવા વેટરનરી કોલેજના આચાર્ય અને ડીનશ્રી ડો. એ. એમ. ઠાકર, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. એસ. કે. ભાવસાર તથા કોલેજના બધા શિક્ષકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.